

(અ.નિ.: અધ્યયન નિષ્પત્તિ- Learning Outcome)

અ.નિ. જોયેલી, સાંભળેલી કે વાંચેલી સામગ્રીમાંથી યોગ્ય તારણ કાઢી પ્રશ્નોના જવાબ લખી શકે છે.

પ્રશ્ન- 1 ફકરાનું વાચન કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

(05)

ગાંધીજીનો માનવીમાંથી ને ઈશ્વરમાંથી વિશ્વાસ ડગ્યો ન હતો. ગાંધીજીએ તો ઘણા આઘાતો અનુભવ્યા હતા. હૃદયને ભાંગી નાખે એવા પ્રસંગો જોયા હતા. આ બધી વખતે તેમને ક્યાંથી શક્તિ મળતી તે વિશે એમણે કહ્યું હતું: “ પ્રાર્થનાએ જ મને બચાવ્યો છે, પ્રાર્થના વિના હું ક્યારનો ગાંડો બની ગયો હોત. મને થયેલા કડવામાં કડવા અને જાહેર અનુભવો થોડો વખત મને નાસીપાસ કરતા પણ પ્રાર્થનાથી મારો નિરાશાનો અંધકાર દૂર થતો. પ્રાર્થના સત્યની જેમ જ મારા જીવનની જોડે વણાઈ ગઈ છે. રોજબરોજ મને આઘાત આપનારાને દુઃખી કરનારા એટલા બનાવો બને છે કે જો આવે વખતે પણ મારા હૃદયમાં રહેલા પરમાત્માનો મેં અનુભવ ન કર્યો હોત તો મારું મગજ જામી ગયું હોત.”

1. ગાંધીજી શા માટે નાસીપાસ થઈ જતા હતા?
2. પરમાત્માનું રહેઠાણ ક્યાં છે?
3. પ્રાર્થનાએ ગાંધીજીને શું શીખવ્યું?
4. ગાંધીજીએ માનવી પરથી વિશ્વાસ ડગ્યો નથી એમ શાથી કહ્યું?
5. આ ફકરાનું યોગ્ય શીર્ષક લખો.

અ.નિ. પરિચિત પ્રસંગો, સ્થળો અને પરિસ્થિતિ વિશેના પોતાના અનુભવોની રજૂઆત કરે છે.

પ્રશ્ન : 2 આપેલા પ્રશ્નોના જવાબ આપો.

1. તમારી શાળામાં ક્યાં ક્યાં સમાચારપત્રો આવે છે? 1
2. બાળકો શનિવારની શા માટે આતુરતાથી રાહ જુએ છે? 1
3. આડી ચાવી – ઊભી ચાવી- શબ્દરમત દ્વારા તમને શો ફાયદો થાય છે? 1
4. ઘરે રહીને અભ્યાસ કરતી વખતે કઈ પ્રવૃત્તિ તમને વધુ ગમે છે? શા માટે? 2

અ.નિ. સમાનાર્થી શબ્દો , વિરુદ્ધાર્થી શબ્દો ,વચન, કાળ, વાક્યના પ્રકાર , સંજ્ઞા, વિશેષણ સહિત વ્યાવહારિક વ્યાકરણનો ઉપયોગ કરે છે

પ્રશ્ન:3(અ) આપેલ શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો. (ખબર, કેળવણી, અનોખું)

3

શિ	અ	લ	ગ	સ
ક્ષ	ણ	ખ	જુ	મા
ણ	મ	દુ	બા	ચા
અ	મ	ળ	ત	ર

પ્રશ્ન:3(બ) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. (અતિશય, બહાદુર, પ્રથમ)

2

1.ઠંડીના કારણે તેના હોઠ ફાટી ગયા હતાં.
2. તમે તો એટલાં બધાં કે ઉંદર જોઈને નાહાં!

અ.નિ. બિલ, રિસિપ્ટ, રિપોર્ટ, મિનિટ્સનો માહિતી માટે ઉપયોગ કરી શકે છે.

પ્રશ્ન -4 પુસ્તક ખરીદીના બિલનો અભ્યાસ કરી નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો.

પુસ્તક ભંડાર				
તારીખ 14/11/ 2020				
" ગમતાંનો કરીએ ગુલાલ....."				
વિદ્યાર્થીનું નામ: રિતેષ કાપડિયા			બિલ નંબર: 3૫૦	
શાળાનું નામ: સરસ્વતી વિદ્યામંદિર			તારીખ 14/11/ 2020	
ક્રમ	પુસ્તકનું નામ	કિંમત (રૂ)	નંગ	વેચાણકિંમત(રૂ)
1.	ભાગવતકથાઓ	200/-	1	180=00
2.	મિયાં કુસકી	60/-	1	52=00
3.	રોજગાર સમાચાર	100/-	1	80=00
4.	સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન	300/-	1	270=00
5.	પરિકથાઓ	60/-	1	52=00
		720/-	5	634=00
છસો ચોત્રીસ પુરા			રોકડા	634=00
નોંધ: દર વર્ષે 14 નવેમ્બરના રોજ વિદ્યાર્થીઓને આકર્ષક વળતરનો લાભ મળશે.				

પ્રશ્નો:

1. ગમતાનો કરીએ ગુલાલ- દ્વારા 'પુસ્તકભંડાર' નો કયો ગુણ ખબર પડે છે? 1
અ. પુસ્તક વાચનનો શોખ બ. બાળક પ્રત્યેનો શોખ
ક. કુશળ વિકેતાનો ડ. પ્રિય વસ્તુ બીજાને આપવાનો આનંદ
2. નોકરી અંગેની માહિતી કયા પુસ્તકમાંથી મળશે? 1
3. રિતેષના દાદીને ઉપરનામાંથી કયું પુસ્તક વધારે ગમશે? 1
4. તમારા શિક્ષકને રિતેષ જેટલું વળતર મળશે? શા માટે? 1
5. બિલના આધારે રિતેષના વ્યક્તિત્વની વિશેષતાઓ લખો. 1

અ.નિ. સ્વતંત્ર લેખન કરે છે.

પ્રશ્ન:5(અ) તમારી દૃષ્ટિએ સારા અક્ષરના ફાયદા કયા કયા છે? 2

પ્રશ્ન: (બ) પત્રકાર તરીકે તમે ગામના સરપંચ અથવા તમારા વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિને કયા-કયા પ્રશ્નો પૂછશો? (ત્રણ પ્રશ્નો લખો) 3